



રાજકોટ મહાનગરપાલિકા

ટ્રાફિક, ટ્રાન્સપોર્ટેશન પાર્કિંગ મેનેજમેન્ટ શાખા  
ત્રીજો માળ, મલ્ટીએક્ટીવીટી સેન્ટર, નાના મવા સર્કલ,  
૧૫૦ રીંગ રોડ, રાજકોટ. ઇ મેઇલ-trafficcell@rmc.gov.in

સ્વચ્છ  
સર્વેક્ષણ  
2Q21  
માર્ચ રાજકોટ  
સ્વચ્છ રાજકોટ

રાજકોટ શહેરનીજુદી જુદી પે એન્ડ પાર્ક સાઇટો પર પાર્કિંગ સંચાલનના કામનું ટેન્ડર

તી. \_\_\_\_\_

પ્રતિ

મ્યુનીસીપલ કમિશ્નર

રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ

હું/અમે

આ ફોર્મ સાથે આપેલ ટેન્ડરની વિવિધ શરતોને વાંચેલ છે. આ સાથે હું/અમે આ સાથે આ ટેન્ડરના ભાગ રૂપે તમામ શરતોને આધીન રહી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પડાયેલ ટેન્ડર પ્રક્રિયામાં સામેલ થઈએ છીએ. આ સાથે અમોએ પણ સમજીએ છીએ કે ટેન્ડર શરતોને આધીન, ટેન્ડર પાસ થવાની સાથે જો અમો ટેન્ડર માટે અસ્વીકૃતિ/અસમર્થ થવાના સંજોગોમાં અમારી અર્નેસ્ટ મની ડીપોઝીટ જપ્ત કરાશે તથા ખાલસા થશે.

આ ટેન્ડર ફોર્મ સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત અર્નેસ્ટ મની ડીપોઝીટ \_\_\_\_\_ - અંકે રૂ. \_\_\_\_\_ પુરા રાજકોટ મહાનગરપાલિકાની હિસાબી શાખામાં ભરેલ છે.

અમો નીચે સહી કરનાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત ટેન્ડરની તમામ શરતોને આધીન રહી આ ટેન્ડર પ્રક્રિયા તથા પછી કરવાની તમામ કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના નિયમોને આધીન રહી સુચારુ રૂપે હાથ ધરીશું.

આ સાથે અમને રાજકોટ મહાનગરપાલિકાની આ કામગીરી માટેની તમામ શરતો મંજૂર છે.

ટેન્ડર ભરનારનું નામ અને એડ્રેસ:

\_\_\_\_\_  
\_\_\_\_\_  
\_\_\_\_\_

મો. \_\_\_\_\_

સહી: \_\_\_\_\_

ભાવ પત્રક

ક્રમ	સાઈટનું નામ	નિયત કરેલ અપસેટ પ્રાઈઝ	સાઈટ માટે ઓફર /બીડ કરેલ એવરેજ(વાર્ષિક) લાઈસન્સ ફી ની રકમ રૂ. (અંકમાં)	સાઈટ માટે ઓફર /બીડ કરેલ એવરેજ(વાર્ષિક)લાઈસન્સ ફી ની રકમ રૂ. (શબ્દોમાં)
૧.				
૨.				
૩.				
ફૂલ રકમ				

આ સાથે નીચે મુજબના જરૂરી કાગળ મારા/અમારા ટેન્ડર સાથે બીડાણ તરીકે સામેલ છે.

૧. અર્નેસ્ટ મની ડીપોઝીટ ભર્યાની ખરી નકલ અથવા ડીમાંડ ડ્રાફ્ટ
૨. ઓફીસ/રેસીડેન્સ પ્રૂફની ખરી નકલ
૩. પાન કાર્ડની નકલ તથા જી.એસ.ટી સર્ટીફિકેટ ( જે ધરાવતાં હોય તો)
૪. પરવાનેદારો ની આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ ની નકલ

(ખાસ નોંધ: સાઈટ માટે નાં ભરેલ ભાવો ઉપરાંત સરકારશ્રી નાં નિયમો ને આધીન જી.એસ.ટી તથા ટી.ડી.એસ અલગથી ભરવાનો રહેશે.)

ટેન્ડર ભરનારનું નામ અને એડ્રેસ:

\_\_\_\_\_

\_\_\_\_\_

\_\_\_\_\_

મો. \_\_\_\_\_

સહી: \_\_\_\_\_

### ટેન્ડરની શરતો:-

૧. ટેન્ડર પ્રક્રિયા મુજબ પે એન્ડ પાર્ક સ્થળોની વિગત અથવા સંબંધિત માહિતી ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેતા ઇસમોએ ટેન્ડર ભરતા પહેલાસ્થળ તપાસ કરીને મેળવી લેવાની રહેશે . પે એન્ડ પાર્ક માટે ફાળવવામાં આવેલ સ્થળ બાબતે કોઈપણ માંગણી પછી માન્ય રહેશેનહિ.
૨. ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે રૂ.૩૦,૦૦૦/- અંકે રૂપિયા(ત્રીસ હજાર રૂપિયા પુરા)અર્નેસ્ટ મની ડીપોઝીટ રોકડા કે ડીમાન્ડ ડ્રાફ્ટ પેટે રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ નાં નામ થી જમા કરાવવાના રેહશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયે જો ટેન્ડર સ્વીકારવાની ઇસમ દ્વારા મનાઈ કરાશે અથવા કોઈ અન્ય કારણોસર ટેન્ડર સ્વીકાર્ય નહિ રહે તો આ ડીપોઝીટ જપ્ત કરીરાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાલસા કરવામાં આવશે.
૩. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયે જે ઇસમનાં જે તે સાઈટમાટે રજુ કરેલ સૌથી વધુ હશે તેને સાઈટની ફાળવણી માટે જરૂરી LOA (Letter of Authority) આપવામાં આવશે. જે સબબ દિવસ – ૭(સાત)માં ધોરણસરનું કરારનામું કરી તેઓએ ટેન્ડર રકમની ૨૫% રકમ ડીમાન્ડ ડ્રાફ્ટ કે નેસનલાઈઝ બેંક ની ફિક્સ ડીપોઝીટ( ઓટો રીન્યુઅલ મોડ માં) રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ નાં નામે સિક્યોરિટી ડીપોઝીટની તરફેણમાં ૧ વર્ષ તથા ૯૦ દિવસની વેલીડીટી ધરાવતીઅત્રે ની શાખામાં જમા કરવાની રહેશે. (જો ફિક્સ ડીપોઝીટ ઓટો રીન્યુઅલ મોડ માં ન હોય તો તે બાબત ની સંપૂર્ણ જવાબદારી ટેન્ડર ભરનાર ઇસમ ની રહેશે) ટેન્ડરના સમયગાળા દરમિયાન અધવચ્ચેથી કાર્ય છોડવાના/શરતભંગના કિસ્સામાં કોન્ટ્રાક્ટ રદ કરી સિક્યોરિટી ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે તેમજ જરૂર જણાયે આ એજન્સીને રાજકોટ મહાનગરપાલિકાના કામે ૩ વર્ષ માટે ડીબાર/બ્લેક લીસ્ટ કરવામાં આવશે.
૪. ટેન્ડરમાં ભાગ લેતા ઇસમોએ ટેન્ડર ભરતા સમયે ખુલાસો કરવાનો રહેશે કે ટેન્ડર વ્યક્તિ/પેઢી દ્વારા ભરવામાં આવેલ છે. ટેન્ડર કોઈપણ પાવર ઓફ એટોર્ની અથવા ટ્રાન્સફર માટે બાધ્ય રહેશે નહિ. ઇસમો કે એજન્સી દ્વારા ખોટી કે અપૂરતી માહિતી આપ્યાના સંજોગોમાં રાજકોટ મહાનગરપાલિકા ટેન્ડર રદ કરવાનો અબાધિત હક્ક ધરાવશે.
૫. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત કરેલ ફોર્મ સાથે જ ટેન્ડર, એક બંધ કવરની અંદર સમય મર્યાદામાં ટ્રાફિક ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ મેનેજમેન્ટ શાખા ખાતે માત્ર રજીસ્ટર એ.ડી, સ્પીડ પોસ્ટ કે પોસ્ટ નાં માધ્યમ દ્વારા જ ભરવાના રહેશે, અન્ય કોઈ માધ્યમ થી ટેન્ડર સ્વીકારાશે નહિ તેમજ નિયત મુદત/સમયમર્યાદા બાદ મળેલ કવર રદ થવાને પાત્ર થશે. જે ટેન્ડરો નિયત સમયમર્યાદા માં આવેલ હશે તેવા ટેન્ડરો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયત થયેલ તારીખ અને સમયે ટેન્ડર ભરનાર ઇસમોની હાજરીમાં ખોલવામાં આવશે.
૬. પે એન્ડ પાર્ક માટે ફાળવેલ જગ્યાનો હેતુ માત્ર પાર્કિંગ સુધી સીમિત રહેશે. પાર્કિંગ સાઈટ માટે ફાળવેલ વિસ્તાર સુધી સીમિત રહેશે. પાર્કિંગ માટેફાળવેલ જગ્યાનોપાર્કિંગ હેતુ માટે જ

ઉપયોગ કરવાનો રહેશે. અન્ય કોઈપણ હેતુ માટે કે માલ સામાન રાખવાની સખ્ત મનાય છે. જો આવો કોઈ વસ્તુ - માલ સામાન રાખ્યાનું માલુમ પડશે તો રાજકોટ મહાનગરપાલિકા તેવસ્તુઓ જપ્ત કરી ખાલશા કરી શકાશે. અને આવો માલ રાખવા સંબંધે કોન્ટ્રાક્ટ રદ કરીને, રદ થવાના કારણે જે કોઈ આર્થિક નુકશાન જશે તે ઠેકેદાર કે એજન્સી પાસેથી વસુલ કરવામાં આવશે.

૭. પે એન્ડ પાર્ક સ્થળ પર વસુલ કરવાનો ચાર્જ રા.મ.ન.પા. દ્વારા ટેન્ડરમાં નિયત કરેલ Annexure-“C” મુજબ મુકરર કરવામાં આવેલ છે તે મુજબ જ વસુલ કરવાના રહેશે.ETVM (ઇલેક્ટ્રોનિક ટીકીટ વેન્ડીંગ મશીન) ઇસમોએ સ્વખર્ચે ખરીદવાના રહેશે તથા ટીકીટમાં જે તે પરવાનેદારે પોતાનો મોબાઈલ નંબર દર્શાવવાનો રહેશે.
૮. કોન્ટ્રાક્ટની મર્યાદા ૧(એક) વર્ષની રહેશે. જેવર્ક ઓર્ડરમાં દર્શાવેલ તારીખથી ગણવાની રહેશે. આ સમય મર્યાદા ફેરવવા તથા રીન્યુ કરવાની સત્તા રાજકોટ મહાનગરપાલિકાની રહેશે.નવા ટેન્ડર અન્વયે નવી એજન્સી નિયુક્ત ન થાય તેવા કિસ્સામાં પ્રવર્તમાન ભાવથી સુચના મુજબ ના સમય ગાળા માટે કામગીરી ચાલુ રાખવાની રહેશે.
૯. પાર્કિંગમાં પાર્ક કરેલ વાહનો સંબંધિત કોઈપણ પ્રકારની નુકશાની અથવા અન્ય કોઈ સંજોગોમાં પોલીસ ફરિયાદ કે આ પેટે ચૂકવવાના થતા વળતર માટે રાજકોટ મહાનગરપાલિકા જવાબદાર રહેશે નહિ. આ ખર્ચને પહોંચી વળવા ઠેકેદાર(એજન્સી) એ પદરે( સ્વખર્ચે) થી વીમો લેવો ફરજિયાત છે. તેમજ જરૂરિયાત મુજબની કાનૂની કાર્યવાહી સ્વખર્ચે કરવાની રહેશે.
૧૦. વાહન પાર્કિંગ સંબંધે ધોરણસર રજીસ્ટર નિભાવવાનું રહેશે. તેમાં આસામીનું નામ વાહનનો પ્રકાર, વાહન નંબર, સમય, તારીખ દર્શાવવાના રહેશે. તેમજ સંબંધકર્તા ઇસમને વાહન પાર્ક કર્યાની રસીદ આપવાની રહેશે.
૧૧. પાર્કિંગ કોન્ટ્રાક્ટની મુદત પૂર્ણ થયે જગ્યાનો શાંત નિર્ભય કબજો રાજકોટ મહાનગરપાલિકાને વિના વિવાદે પરત આપી દેવાનો રહેશે.
૧૨. રાજકોટ મહાનગરપાલિકા નાં કમિશ્નર અથવા તેમણે નીમેલા કોઈપણ અધિકારી કે કર્મચારી ગમે ત્યારે પે એન્ડ પાર્કની મુલાકાત લઇ, આ કામે રાખેલ રજીસ્ટર તથા અન્ય સંબંધિત દસ્તાવેજો ચકાસી શકશે.
૧૩. ટેન્ડરમાં જેતે સાઈટ માટે જુદી જુદી એજન્સી તરફથી રજુ થયેલ ભાવો પૈકી જે એજન્સીના ભાવ સૌથી વધુ (H1- Highest) હશેતે એજન્સીને જેતે સાઈટ ફાળવવામાં આવશે.
૧૪. ટેન્ડર માં દર્શાવેલ સાઈટો માટે કોઈ અનુભવની જરૂરિયાત રહેશે નહિ.

૧૫. ટેન્ડર ભરનાર ઇસમોમાં સરકારી/અર્ધ સરકારી/ રાજકોટ મહાનગરપાલિકા નાં કોઈ પણ કામે છેલ્લા ૫(પાંચ)વર્ષમાં ડી-બાર કે બ્લેક લીસ્ટેડ થયેલ નથી તે બાબતે ગુજરાત સરકારશ્રીનાં રેવન્યુ ડીપાર્ટમેન્ટ નાં પ્રવર્તમાન નિયમો મુજબ જરૂરી સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ કરી સોગંધનામું બીડ સાથે રજુ કરવાનું રહેશે.
૧૬. પાર્કિંગ માટે અપાયેલ સાઈટ / જગ્યા માટે વખતો વખત નિર્ણય કરવાની સત્તા રાજકોટ મહાનગરપાલિકા પાસે અબાધિત રહેશે. આ જગ્યા કામચલાઉ કે કાયમી ધોરણે કોઈ અન્ય હેતુસર ફાળવવાની સત્તા રાજકોટ મહાનગરપાલિકાની રહેશે. આ બાબતે કોઈ વાંધો કે કાનૂની કાર્યવાહી થઈ શકશે નહિ. આ જગ્યા ફક્ત એજન્સી ને પાર્કિંગ નાં હેતુ માટે જ લાયસન્સ પદ્ધતિ થી ફાળવેલ છે. એજન્સી ને આ જગ્યા પર નાં કોઈ હકો પ્રાપ્ત થશે નહીં. સદર જગ્યાની માલિકી રાજકોટ મહાનગરપાલિકાની છે અને રહેશે.
૧૭. પે એન્ડ પાર્કિંગ સંચાલન સંભાળનાર એજન્સીએ સરકારશ્રી દ્વારા વખતોવખત નિયત કરવામાં આવતા કરવેરા પરભારે ચૂકવવાના રહેશે. કોઈ પણ નવા વેરા કે ટેક્સ અમલમાં આવ્યે થી તે બાબતે રાજકોટ મહાનગરપાલિકાને વધારાના વેરા/ટેક્સ બાબતે રજુઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
૧૮. ટેન્ડરમાં ભાગ લેતા ઇસમોએ ANNEXURE-A માં દર્શાવેલ એક કે તેથી વધુ સાઈટ માટેના ભાવ (વાર્ષિક લાઈસન્સ ફી) રજુ કરવાના રહેશે. જેમાંએકવર્ષ માટેનાં (વાર્ષિક)ભાવ નિયત કરેલ અપસેટ જેટલા કે તેથી વધુ ભાવ રજુ કરવાના રહેશે.
૧૯. ટેન્ડર અન્વયે રજુ થયેલ અમુક સાઈટ માટેના ભાવ ગ્રાહ્ય રાખવા કે રદ કરવા અંગે આખરી નિર્ણય કમિશ્નર, રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે જે તમામ ટેન્ડર ભરનાર લોકોને બાધ્ય રહેશે.
૨૦. કોઈપણ વાદ વિવાદ બાબતે મ્યુનીસીપલ કમિશનરનો નિર્ણય આખરી અને તમામને બંધનકર્તા રહેશે. તથા કાનૂની કાર્યવાહી થવાના કિસ્સામાં ન્યાયક્ષેત્ર રાજકોટ રહેશે.
૨૧. વાહન ચોરાઈ જાય તેવા કિસ્સામાં વાહન માલિક અને પે એન્ડ પાર્કિંગ સંચાલકે સંયુક્ત પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવાની રહેશે. આ બાબતે અત્રેની શાખા રાજકોટ મહાનગરપાલિકાને કોઈ પણ કાર્યવાહી કરવાની રહેશે નહિ તથા રાજકોટ મહાનગરપાલિકા ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં.
૨૨. પે એન્ડ પાર્કિંગનાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકશાન થાય તેવા કિસ્સામાં કોન્ટ્રાક્ટરે નુકશાન કરનાર એજન્સી પાસેથી પૈસા વસુલાત કરી રાજકોટ મહાનગરપાલિકામાં જમા કરાવવાના રહેશે અને જો એમ કરવામાં નહીં આવે તો નુકશાનનું વળતર કોન્ટ્રાક્ટરે ભરવાનું રહેશે.
૨૩. પે એન્ડ પાર્કિંગ ટેન્ડર સાઈટ પર પેટા કોન્ટ્રાક્ટ આપી શકાશે નહિ. જો પેટા કોન્ટ્રાક્ટ આપેલ હોવાનું માલુમ પડશે તો પે એન્ડ પાર્કિંગ સંચાલન કરતી એજન્સીને ટર્મિનેટ કરી તેની

સિક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે. તેમજ જરૂર જણાયે બ્લોક લીસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

૨૪. કોઈપણ એજન્સી કે વ્યક્તી ઈચ્છા મુજબ ગમે તેટલી સાઈટની બીડ કરી શકશે.
૨૫. જો એજન્સી પાસે એક કરતા વધારે સાઈટ હશે અને કોઈપણ એક સાઈટ ટર્મિનેટ થયા પછી બાકીની સાઈટ ટર્મિનેટ કરવી કે નહિ તેનો નિર્ણય કમિશ્નરશ્રી રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.
૨૬. કોઈપણ એજન્સી દ્વારા અપસેટ પ્રાઈઝ થી ઓછી રકમ બીડને ધ્યાને લેવામાં આવશે નહીં.
૨૭. ઉપરોક્ત તમામ શરતોમાં ફેરફાર કરવાનો અથવા નવી શરતો ઉમેરવાનો નિર્ણય કમિશ્નરશ્રી રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે. જેબીડરને બાધ્ય રહેશે.
૨૮. સ્માર્ટ સીટી મિશન પ્રોજેક્ટ અંતર્ગત જો કોઈપણ સાઈટને સ્માર્ટ પાર્કિંગ તરીકે વિકસાવવામાં આવે તો તેને લગત જરૂરી ફેરફાર એજન્સીએ સુચના મુજબ કરવાના રહેશે તથા આનુસાંગિક ફેરફારો પણ સ્વખર્ચે કરવાના રહેશે.
૨૯. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ દર સુધારવામાં આવ્યે થી ભાવ વધારા તફાવતની રકમ એજન્સીએ અલગથી ચુકવવાની રહેશે. જેમાં કમિશ્નરશ્રીનો નિર્ણય આખરી રહેશે.
૩૦. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થયેથી એજન્સીએ સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ મુજબ પાર્કિંગ પ્લોટનું સંચાલન કરવાનું રહેશે તથા જરૂરિયાત મુજબ મેનપાવરપૂરો પાડવાનો રહેશે તથા સ્માર્ટ પાર્કિંગ માં જરૂર જણાયે પાર્કિંગ પરવાનેદારે રાજકોટ મહાનગરપાલિકા નક્કી કરે તે સુચના મુજબ રેવન્યુ શેરીગનાં ધોરણે સ્માર્ટ પાર્કિંગ ચલાવવાનું રહેશે.
૩૧. હાઇએસ્ટ બીડ રજુ કરનાર એજન્સીને અત્રેથી LOA ( Letter Of Authority ) આપી નિયત સમયમાં સરકારશ્રી નાં પ્રવર્તમાન નિયમ મુજબ સ્વ ખર્ચે નોટરાઈઝડ એગ્રીમેન્ટ કરી તુરંત સિક્યુરીટી ડીપોઝીટ જમા કરાવવા સુચિત કરવામાં આવશે. આ નિયત સમયમાં એગ્રીમેન્ટ કરી સિક્યુરીટી ડીપોઝીટ જમા કરવવામાં નિષ્ફળ જવા બદલ એજન્સીની EMD જપ્ત કરી એજન્સીને ત્રણ વર્ષ માટે રાજકોટ મહાનગરપાલિકાના કામે ડીબાર કરવામાં આવશે.
૩૨. એજન્સીની ગંભીર ફરિયાદો અથવા વારંવાર આવતી ફરીયાદોને ધ્યાને લઈ અત્રેથી અંતિમ નોટીસ આપી ખુલાસો રજુ કરવા એજન્સીને સુચિત કરવામાં આવશે. નિયત સમયમાં ખુલાસો રજુ ન કરવો અથવા ખુલાસામાં રજુ કરેલ કારણો કે બાબતો ગ્રાહ્ય રાખી શકાય તેવા ન હોય તેવા કિસ્સામાં એજન્સીની સિક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરી તેના હસ્તકની તમામ સાઈટો હસ્તગત કરી એજન્સીને વધુમાં વધુ ત્રણ વર્ષ માટે રાજકોટ

મહાનગરપાલિકાનાં કામે ડીબાર કરવામાં આવશે. આ અંગે કમિશ્નરશ્રી રાજકોટ મહાનગરપાલિકાનો નિર્ણય એજન્સીએ ગ્રાહ્ય રાખવાનો રહેશે.

૩૩. દિવસ દરમ્યાન ઓછામાં ઓછી ૧૨ કલાક પે એન્ડ પાર્ક કાર્યરત રાખવાનું રહેશે.
૩૪. પે એન્ડ પાર્ક માટે સોંપવામાં આવેલ પ્લોટ ને જરૂરી સાફ સફાઈ એજન્સી એ પરભારે કરવાની રહેશે તેમજ જરૂરી ડસ્ટબિન રાખવાની રહેશે.
૩૫. રાજકોટ મહાનગરપાલિકાની જરૂરિયાત જણાયે આ પ્લોટને અન્ય સ્થળે ખસેડવા કે તેને રદ કરવાનો થાય તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટીસ આપી સાઈટ રદ કરી શકશે તેમજ એજન્સીએ તેનો કબજો રાજકોટ મહાનગરપાલિકાને સોંપી આપવાનો રહેશે, વધારાનો સમય માટે લાઈસન્સ ફી પ્રોરેટા મુજબ ગણતરી કરી પરત કરવામાં આવશે.
૩૬. સ્માર્ટ પાર્કિંગ સબબ સાઈટ ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવેલ સાધન/ સામગ્રીની જાળવણી એજન્સીએ કરવાની રહેશે. તેને નુકશાન થવાના કિસ્સામાં નુકસાનીની રકમ એજન્સીએ ભરપાઈ કરવાની રહેશે તથા સ્માર્ટ પાર્કિંગ સબબ જરૂરિયાત મુજબનાં મેન-પાવર ની એજન્સી એ સ્વ ખર્ચે વ્યવસ્થા કરવાની રહેશે તથા સ્માર્ટ પાર્કિંગ સબબ નાં જે તે સમય નાં નિયમો એજન્સી ને બંધનકર્તા રહેશે.
૩૭. ફાળવેલ સાઈટની સાઈઝમાં ફેરફાર કરવાની જરૂરિયાત જણાયે તેમાં ફેરફાર કરવાનો અધિકાર કમિશ્નરશ્રીનોરહેશે. જે એજન્સીએ ગ્રાહ્ય રાખવાનો રહેશે.
૩૮. રાજકોટ મહાનગરપાલિકાને કોઈપણ કામ/કાર્યક્રમ સબબ કોઈપણ સાઈટની જગ્યાની જરૂરિયાત ઉભીથાય તો એજન્સીએ કોઈપણ વાદવિવાદ વગર તે સાઈટનોકબજો હંગામી ધોરણે રાજકોટ મહાનગરપાલિકાને આપવાનો રહેશે. આ ફાળવેલ દિવસો તેની ટેન્ડરની મુદતમાં વધારી આપવામાં આવશે.
૩૯. પે એન્ડ પાર્કની કામગીરી સબબ કોઈ અકસ્માતે ઈજા/નુકશાની/જાનહાની થાય તો તે સબબ એજન્સી કે તેનો સ્ટાફ રાજકોટ મહાનગરપાલિકા પાસે કોઈપણ પ્રકારનું વળતર કે દાવો રજૂ કરી શકશે નહીં.
૪૦. પે એન્ડ પાર્ક ખાતે ઈલેક્ટ્રીસીટી અને પાણીની લાઈનની જરૂરિયાત જણાય તોતે સંચાલન કરતી એજન્સીએ સ્વખર્ચે તેની વ્યવસ્થા પરભારે કરવાની રહેશે. રાજકોટ મહાનગરપાલિકા તરફથી ફક્ત NOC (No Objection Certificate) આપવામાં આવશે.
૪૧. પે એન્ડ પાર્કમાં વાહન પાર્ક કરતા રાજકોટ મહાનગરપાલિકાની અસ્કયામતને નુકશાન થાય તો તેની ભરપાઈ એજન્સીએ કરવાની રહેશે, જો તેમ કરવામાં ન આવે તો તેની સીક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરી એજન્સીને ત્રણ (૩) વર્ષ માટે રાજકોટ મહાનગરપાલિકાના કામે ડી-બાર(બ્લેક લીસ્ટ) કરવામાં આવશે.

૪૨. એજન્સીએ એક બંધ કવરમાં “ટેકનીકલ બીડ” અને બીજા બંધકવરમાં “પ્રાઈઝ બીડ” એ રીતે કવર ઉપર લખી આ બંને કવરને ત્રીજા કવરમાં રાખી તેની ઉપર “Pay& Park Tender” એવું લખી શીલ બંધ કરી રજીસ્ટર એડી કે પોસ્ટ નાં કોઈ પણ માધ્યમ થી નિયત તારીખ ૧૫.૦૨.૨૦૨૧ સાંજના ૦૬:૦૦ કલાક સુધીમાં અત્રેની કચેરીએ પહોંચતું કરવાનું રહેશે.
૪૩. વાહન સ્ટેન્ડની કામગીરી અંગે જરૂરી સરકારી/અર્ધસરકારી અથવા મહાનગરપાલિકાના પરવાના ઈજારદારે/એજન્સી એ મેળવી લેવાના રહેશે.
૪૪. ઈજારા/ પે એન્ડ પાર્ક ની મુદત પુરી થયા બાદ રાજકોટ મહાનગરપાલિકા એજન્સી કે તેના માણસોને ઈજારાના સ્થળમાં પ્રવેશ કરતા અટકાવી શકાશે. તથા ઈજારદારે સ્થળે રાખેલ તેમની સાધન સામગ્રી તાત્કાલિક ખસેડી લેવાની રહેશે. અન્યથા રાજકોટ મહાનગરપાલિકા આવી તમામ સાધન સામગ્રી ઈજારદાર/એજન્સીનાં ખર્ચે અને જોખમે સ્થળ પરથી દુર કરશે.
૪૫. કમિશ્નરશ્રી તથા તેમના અધિકૃત અધિકારી ધ્વારા સહી કરેલ નોટીસ સુચના વિ. સાચકલ, સ્કુટર સ્ટેન્ડ કે પાર્કિંગ સાઈટ ની જગ્યા ઉપર લગાડવામાં આવે તો તે ઈજારદારને મળ્યા બરાબર ગણાશે.
૪૬. ઈજારો મંજૂર થતાં ઈજારદારે તેમના રહેઠાણ તથા ધંધાના સ્થળનું પુરેપુરું ટપાલનું સરનામું, ફોન નંબર, ફેક્ષ નંબર તથા ઈ-મેલ આઈડી વિગેરે વિગતો પુરી પાડવાની રહેશે તથા ભવિષ્યમાં તેમાં કોઈ ફેરફાર થાય તો તેની જાણ તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાને લેખિતમાં કરવાની રહેશે. ઈજારદારે/એજન્સી એ જણાવેલ સરનામા/ડીજીટલ મેસેજ જેવા કે ટેક્સ્ટ મેસેજ, વોટ્સ અપ મેસેજ, ઈ- મેલ મેસેજ ઉપર રાજકોટ મહાનગરપાલિકા ધ્વારા જે કાંઈ પત્ર વ્યવહાર કરવામાં આવે તે ઈજારદારને મળ્યા બરાબર ગણાશે.
૪૭. પે એન્ડ પાર્કના પરવાના ફી ની રકમ ઉપરાંત રાજ્ય સરકારના નક્કી થયેલા ચાર્જ કે વખતોવખત લાગુ પડતા જે તે કાયદા હેઠળ નક્કી થતા ચાર્જ કે સરકારી/અર્ધસરકારી ટેક્ષ/ચાર્જ/ફી/વેરા ભરવાપાત્ર થતા તમામ વેરા આપવાની જવાબદારી પરવાનો રાખનારની રહેશે. ઉપરોક્ત ઈજારાની મુદત પુરી થયા બાદ પણ જો સરકારશ્રી / મહાનગરપાલિકા તરફથી આવું લેણું નીકળતુ હશે તો રાજકોટ મહાનગરપાલિકા ઈજારદાર પાસેથી તેવું લેણું વસુલ લેવા હકકદાર રહેશે.
૪૮. પે એન્ડ પાર્કમાં નક્કી કરેલ વાહનો નિયત થયેલ પાર્કિંગ વિસ્તારમાં જ પાર્ક કરાવવાનાં રહેશે તેમજ પે એન્ડ પાર્ક વિસ્તારમાં “ વાહન ચાલકે પોતાના ખર્ચે તથા જોખમે વાહન પાર્ક કરવું” ( Park At Vehicle owner’s risk ) તેવું બોર્ડ પ્રદર્શિત કરવાનું રહેશે.



૪૯. ઈજારદાર તરફથી સાઈટ ઉપર જે માણસો રોકવામાં આવે તે અંગે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓનાં તમામ લાગુ પડતા નીતિ નિયમોનું કાયદાની મર્યાદામાં રહી પાલન કરવાનું રહેશે. ઈજારદારે સ્થળ ઉપર રોકેલ માણસોને લઘુત્તમ વેતનથી ઓછો પગાર આપી શકાશે નહીં. જો ઈજારદાર તરફથી આવા કોઈ પણ નીતિ નિયમ કાયદાનું પાલન થાય નહિં/ઉલ્લંઘન થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી ઈજારદારની રહેશે અને રાજકોટ મહાનગરપાલિકાને એવા ઉલ્લંઘન માટે કોઈ પણ રીતે જવાબદાર ઠેરવી શકાશે નહીં.

૫૦. પાર્કિંગ કોન્ટ્રાક્ટરશ્રી એ રાજ્ય સરકારશ્રી/ કેન્દ્ર સરકારશ્રી ની કોવીડ-૧૯ ની ગાઈડલાઈન્સ નું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.

૫૧. રાજકોટ મહાનગરપાલિકા માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર બ્રીજ નીચે આવેલ પાર્કિંગ માં કોઈ પણ મોટા વાહનો જેવા કે ટ્રક, વોલ્વો બસ જેવા વાહનો પાર્ક કરવાના રહેશે નહીં ફક્ત ૨ વ્હીલર, ૪ વ્હીલર કાર જેવા વાહનો જ પાર્ક કરવાનાં રહેશે તથા વાહન પાર્કિંગ વખતે બ્રીજ નીચે આવેલ જાહેરાત નાં બોર્ડ ને વાહન અડચણ રૂપ ન થાય તથા પાર્કિંગ કરેલ વાહનો દ્વારા જાહેરાત નાં બોર્ડ ને નુકસાન ન થાય તેની તકેદારી રાખવાની રહેશે જો જાહેરાત નાં બોર્ડ ને કોઈ પણ નુકસાન થાય તો તેનો તમામ ખર્ચ પાર્કિંગ પરવાનેદારે ભોગવવાનો રહેશે.

૫૨. પાર્કિંગ પરવાનેદારે પાર્કિંગ દર મુજબ જ ભાવ વસુલવાનાં રહેશે તથા વધુ ભાવ વસુલ્યેથી નિયમાનુસાર દંડ તથા શરતભંગ ની કાર્યવાહી કરવામાં આવશે.

## -: પેનલ્ટીની શરતો:-

૧. નિયતચાર્જથી વધુ ચાર્જ વસુલાત કર્યા અંગેની ફરિયાદ અન્વયે કસુરવાર જણાયે રૂ. ૧,૦૦૦/- થી લઈ રૂ. ૧૦,૦૦૦/- સુધીની પેનલ્ટી વસુલવાની સત્તા રાજકોટ મહાનગરપાલિકાની રહેશે. તેમજ જરૂર જણાયે એજન્સીની સિક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરવાસાથે બ્લેકલીસ્ટ કરવા સુધીના પગલા લેવાનો અધિકાર રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.
૨. પાર્કિંગ વ્યવસ્થા માટે રાખેલ માણસોના ૨(બે) ફોટા, રેસીડન્સ પ્રૂફ, ઉંમરનો પુરાવો, વિગેરે વિગત રાજકોટ મહાનગરપાલિકાની ટ્રાફિક, ટ્રાન્સપોર્ટએન્ડ પાર્કિંગ શાખા ખાતે રજુ કરી મંજૂરીતથા આઈ.ડી. મેળવવાના રહેશે. મંજૂરી વગરના માણસો રાખી શકાશે નહિ. મંજૂરી વગરના માણસો ધ્યાને આવ્યેથી પ્રતિ દિન/વ્યક્તિ દૈનિક રૂ. ૫૦૦/- લેખે પેનલ્ટી આપવામાં આવશે.
૩. પાર્કિંગ સાઈટનું સંચાલન સંભાળવાથી તે સંબંધે રાજકોટ મહાનગરપાલિકામાં સંબંધ કર્તાનો કોઈપણ પ્રકારનો હક્ક પ્રસ્થાપિત થશે નહિ. આવો ઉપયોગ કર્યાનો ધ્યાને આવ્યેથી રૂ. ૧,૦૦૦/- થી લઈ રૂ. ૫૦૦૦/- સુધીની પેનલ્ટી વસુલવા સાથે અને/અથવા કરાર રદ કરી જમા કરાવેલ સિક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરવાસાથે બ્લેકલીસ્ટ કરવા સુધીના પગલા લેવાનો અધિકાર રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.
૪. પે એન્ડ પાર્ક સાઈટ પર કોન્ટ્રાક્ટર અથવા તેના સ્ટાફ દ્વારા અરજદાર સાથે ગેર વર્તણુક કર્યા હોવાનું ધ્યાને આવશે તો તેને નોટીસ આપી ખુલાશો રજુ કરવા તેમજ રૂ. ૧,૦૦૦/- થી લઈ રૂ. ૫,૦૦૦/- સુધીની પેનલ્ટી બનવાની ગંભીરતાને આધીન રહીને વસુલવામાં આવશે.
૫. પે એન્ડ પાર્કની સાઈટ પર સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન કોન્ટ્રાક્ટર અથવા તેના સ્ટાફ ગેરહાજર જણાય તો રૂ. ૨,૦૦૦/-ની પેનલ્ટી કરવામાં આવશે.
૬. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન પે એન્ડ પાર્કની સાઈટ પર વાહનોની પહોંચ બનાવવામાં ન આવેલ હોય તેવા કિસ્સામાં પ્રતિ વાહન સ્ફૂટર રૂ. ૨૦/- અને મોટરકારના રૂ. ૫૦/- લેખે પેનલ્ટી વસુલવામાં આવશે.
૭. પાર્કિંગની જગ્યામાં પાર્કિંગ હેતુ સિવાય અન્ય ઉપયોગ તથા પાર્કિંગ સાઈટ ની વારંવાર ફરીયાદ ધ્યાને આવ્યેથી નોટીસ આપી બાબતની ગંભીરતા અનુસાર રૂ.૧૦૦૦/- થી રૂ.૧૦,૦૦૦/- સુધીની પેનલ્ટી કરવા તેમજ કોન્ટ્રાક્ટ રદ કરી સિક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરવા સાથે બ્લેકલીસ્ટ કરવા સુધીના પગલા લેવાનો અધિકાર રાજકોટ મહાનગરપાલિકાને રહેશે.
૮. પાર્કિંગ પ્લેસ માટે ફાળવેલ સાઈટ કે તેનો ચોક્કસ ભાગ કોઈ વ્યક્તિ કે એજન્સીને ફાળવવા જેવા બનાવને ધ્યાને લઈ નોટીસ આપી ખુલાસો રજુ કરવા અને બાબતની ગંભીરતા અનુસાર

રૂ.૧૦૦૦/- થી રૂ.૧૦,૦૦૦/- સુધીની પેનલ્ટી કરવા તેમજ કોન્ટ્રાક્ટ રદ કરી સિક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરવા સાથે બ્લેકલીસ્ટ કરવા સુધીના પગલા લેવાનો અધિકાર રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.

૯. એજન્સીને ફાળવેલ સાઈટનું સંચાલન તેઓશ્રીએ કરવાનું રહેશે.અન્ય કોઈ વ્યક્તિ કે એજન્સીને પેટા કોન્ટ્રાક્ટ થી આપી શકાશે નહીં. જો આવુંધ્યાને આવ્યેથી નોટીસ આપી ખુલાસો રજૂ કરવા અને બાબતની ગંભીરતા અનુસાર રૂ.૫૦૦૦/- થી રૂ.૨૦,૦૦૦/- સુધીની પેનલ્ટી કરવા તેમજ કોન્ટ્રાક્ટ રદ કરી સિક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરવા સાથે બ્લેકલીસ્ટ કરવા સુધીના પગલા લેવાનો અધિકાર રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.

૧૦. એજન્સીનેઈ.ટી.વી.એમ. મશીન બંધ થઈ જવાના કિસ્સામાં ૪૮ કલાકમાં રિપેરિંગ કરી કાર્યરત કરવાનું રહેશે તેમ ન થવાના કિસ્સામાં પ્રતિ દિન રૂ. ૧૦૦/- લેખે પેનલ્ટી થશે.

૧૧. પે એન્ડ પાર્ક દિવસ દરમ્યાન ઓછામાં ઓછું ૧૨ કલાક કાર્યરત કરવાનું રહેશે. તેનો ભંગ થવા બદલ રૂ. ૨૦૦/- લેખે પેનલ્ટી આપવામાં આવશે.

૧૨. ટેન્ડરમાં દર્શાવેલ ચાર્જીસ અંગેનું બોર્ડ દરેક સાઈટ પર એજન્સીએ નિભાવવાનું રહેશે. અન્યથા પ્રત્યેક દિન માટે રૂ.૧૦૦૦/ ની પેનલ્ટી પ્રતિદિન લેખે વસુલ કરવામાં આવશે અથવા કોન્ટ્રાક્ટ રદ કરી સિક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરવા સાથે બ્લેકલીસ્ટ કરવા સુધીના પગલા લેવાનો અધિકાર રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.

## પાર્કિંગ સાઈટ ની વિગતો :

ક્રમાંક	સાઈટ	વિસ્તાર અંદાજિત (ચો.મી)	ટેન્ડર ભાવ
૧	સર્વેશ્વર ચોક	૧૨૨૫	૨,૫૦,૦૦૦
૨	ત્રિકોણ બાગ	૨૨૫	૧,૫૦,૦૦૦
૩	અખા ભગત ચોક	૪૨૪	૧,૨૫,૦૦૦
૪	ધનરજની બિલ્ડિંગ,(ઈમ્પીરીયલ હોટેલ) થી જીલ્લા પંચાયત ચોક સુધી, બન્ને બાજુ	૧૦૦૦	૧,૦૦,૦૦૦
૫	માધવ પાર્કિંગ કોઠારીયા ચોકડી, નીચર રીંગ રોડ.	૮૧૯૫	૧,૦૦,૦૦૦
૬	ઓપન પ્લોટ ઢેબર રોડ ભાગ-૩	૧૨૦૦	૧,૦૦,૦૦૦
૭	નાગરીક બેંક સામે, ઢેબરભાઈ રોડ કોર્નરનો પ્લોટ	૧૨૦૦	૧,૦૦,૦૦૦
૮	મોચી બઝાર કોર્ટ થી પેટ્રોલ પંપ રોડ.	૩૧૦	૮૦,૦૦૦
૯	આલ્ફ્રેડ હાઈસ્કૂલ થી ભાભા હોટેલ	૧૯૦	૩૬,૦૦૦
૧૦	તનિષ્ઠ ટાવર થી માલવીયા ચોક.	૧૮૦	૭૫,૦૦૦
૧૧	આર.કે.સી. ની દીવાલ રાધાકિષ્ણ રોડ	૧૬૫	૭૦,૦૦૦
૧૨	જયુબેલી શાક માર્કેટ	૫૫૦	૭૫,૦૦૦
૧૩	ઢેબર ભાઈરોડ ભાગ-૨	૫૨૫	૨૫,૦૦૦
૧૪	ઢેબર ભાઈરોડ ભાગ-૪	૪૨૫	૩૦,૦૦૦
૧૫	પારડી રોડ કોમ્યુનીટી હોલની બાજુમાં વોર્ડ નં ૧૭	૧૬૧૫	૬૦,૦૦૦
૧૬	ઓપન પ્લોટ નહેરુનગર ૮૦ ફૂટ રોડ યોગેશ્વર સોસાયટી	૧૦૩૦	૪૦,૦૦૦
૧૭	જાગનાથ મંદીર આગળનો ઓપન પ્લોટ .	૫૮૮	૭૫,૦૦૦
૧૮	કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ચોક થી કોર્પોરેશન ચોક સુધી રોડની બંને બાજુ,	૨૫૫૫	૮૦,૦૦૦
૧૯	PDM કોલેજથી જુના જકાતનાકા, ગોંડલ રોડ સુધીબંનેબાજુ	૨૫૦૦	૮૦,૦૦૦
૨૦	લાખાજીરાજ રોડ	૧૧૫૦	૧,૦૦,૦૦૦
૨૧	કે.કે.વી.ચોક થી ઇન્દિરા સર્કલ તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) ફ્લાઈ ઓવર નીચે ભાગ-૨.	૧૩૦૦	૧,૦૦,૦૦૦
૨૨	કે.કે.વી.ચોક થી ઇન્દિરા સર્કલ તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (૫)	૧૩૦૦	૧,૦૦,૦૦૦
૨૩	કે.કે.વી.ચોક થી બીગ બજાર તરફનું આથમણી બાજુએ (વેસ્ટ), ફ્લાઈ ઓવર નીચે ભાગ-૬.	૧૧૦૦	૧,૦૦,૦૦૦
૨૪	બી.આર.ટી.એસ.ગોંડલ રોડ ચોકડી ફક્ત એક બાજુ	૧૭૫	૫૦,૦૦૦

૨૫	આત્મીય કોલેજ થી કિસ્તલ મોલ.	૧૭૨૭	૧,૦૦,૦૦૦
૨૬	કે.કે.વી. ચોકથી બીગ બજાર તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ(૧)	૮૭૫	૭૫,૦૦૦
૨૭	ઇન્દિરા સર્કલથી રૈયા ટેલીફોન તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (૩)	૧૯૫૦	૯૦,૦૦૦
૨૮	ઇન્દિરા સર્કલથી રૈયા ટેલીફોન તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (૪)	૧૯૫૦	૯૦,૦૦૦
૨૯	ગોવર્ધનચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ.(ફોરચ્યુન હોટલ પાસે)	૧૨૫૦	૫૦,૦૦૦
૩૦	મવડી ચોકડી થી ગોંડલ ચોકડી તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (૧)	૭૬૫	૭૫,૦૦૦
૩૧	મવડી ચોકડી થી નાનામવા ચોકડી તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (૨)	૭૬૫	૭૫,૦૦૦
૩૨	મવડી ચોકડી થી નાનામવા ચોકડી તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (૩)	૭૬૫	૭૫,૦૦૦
૩૩	મવડી ચોકડી થી ગોંડલ ચોકડી તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (૪)	૭૬૫	૭૫,૦૦૦
૩૪	રૈયા ચોકડી થી ઇન્દિરા સર્કલ તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (૧)	૭૬૫	૭૫,૦૦૦
૩૫	રૈયા ચોકડી થી નાણાવટી ચોક તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (૨)	૭૬૫	૭૫,૦૦૦
૩૬	રૈયા ચોકડી થી નાણાવટી ચોક તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (૩)	૭૬૫	૭૫,૦૦૦
૩૭	રૈયા ચોકડી થી ઇન્દિરા સર્કલ તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનો ભાગ (૪)	૭૬૫	૭૫,૦૦૦
૩૮	સ્ટર્લીંગ હોસ્પિટલ ની બાજુમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ	૪૦૦	૭૫,૦૦૦
૩૯	ઓપન પ્લોટ સત્ય સાઈ હોસ્પિટલ રોડ	૩૩૦૦	૬૦,૦૦૦
૪૦	ઓપન પ્લોટ પંચાયત નગર ચોક	૫૮૯	૭૦,૦૦૦
૪૧	ઓપન પ્લોટ હુડકો ક્વાટરની પાછળ.	૧૬૫૦	૯૦,૦૦૦
૪૨	અટલ બીહારી વાજપાઈ ઓડીટોરિયમ સામેનો ઓપન પ્લોટ.	૧૦૦૦	૭૦,૦૦૦
૪૩	ઓપન પ્લોટ ટી.પી. ૧૧ એફ.પી. ૪૬ વોર્ડ નં ૧૮ (પુરુષાર્થ સોસાયટી)	૬૫૦૦	૮૦,૦૦૦

## પે & પાર્ક ના દર (ચાર્જ) દર્શાવતું ભાવ પત્રક

ક્રમ	વિગત	સમય	ચાર્જ રૂપિયા માં
૧	હેવી વ્હીકલ વાહનો( બસ, ટ્રક, જેસીબી, મેટાડોર, ટ્રેક્ટર અને મોટા વાહનો)	૧ કલાક	૧૦/-
		૨ કલાક	૨૦/-
		૧૨ કલાક	૫૦/-
		૨૪ કલાક	૧૦૦/-
૨	લાઈટ વ્હીકલ વાહનો (મોટર કાર અને ફોર વ્હીલર)	૧ કલાક	૦૫/-
		૨ કલાક	૧૦/-
		૧૨ કલાક	૨૦/-
		૨૪ કલાક	૪૦/-
૩	ટુ વ્હીલર વાહનો	૧ કલાક	૦૨/-
		૨ કલાક	૦૫/-
		૧૨ કલાક	૧૦/-
		૨૪ કલાક	૨૦/-

## માસિક ભાવ પત્રક નીચે મુજબ છે.

ક્રમ	વિગત	ચાર્જ રૂપિયા માં
૧	હેવી વ્હીકલ વાહનો( બસ, ટ્રક, જેસીબી, મેટાડોર, ટ્રેક્ટર અને મોટા વાહનો)	૭૫૦/-
૨	લાઈટ વ્હીકલ વાહનો (મોટર કાર અને ફોર વ્હીલર)	૩૦૦/-
૩	ટુ વ્હીલર વાહનો	૧૫૦/-

## અગત્યની તારીખો

ટેન્ડરફોર્મ વિતરણ	૨૫.૦૧.૨૦૨૧
પ્રીબીડ મીટીંગ	૦૩.૦૨.૨૦૨૧
ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ	૧૫.૦૨.૨૦૨૧
આવેલ ટેન્ડર ખોલવાની તારીખ	૧૮.૦૨.૨૦૨૧